

VII

**PROTOCOL ADDITIONAL  
TO THE GENEVA CONVENTIONS OF 12 AUGUST 1949,  
AND RELATING TO THE ADOPTION  
OF AN ADDITIONAL DISTINCTIVE EMBLEM  
(PROTOCOL III), OF 8 DECEMBER 2005**

**Preamble**

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

**Third Protocol emblem**

.....  
.....

## VII

( ),

### PREAMBLE

*The High Contracting Parties,*

( ) *Reaffirming* ,



1. The emblem of the third Protocol shall be used by the Parties to the Protocol in accordance with the provisions of this Article.

### *Article 3 — Indicative use of the third Protocol emblem*

1. The emblem of the third Protocol shall be used by the Parties to the Protocol in accordance with the provisions of this Article.

a) The emblem of the third Protocol shall be used by the Parties to the Protocol in accordance with the provisions of this Article.

b) The emblem of the third Protocol shall be used by the Parties to the Protocol in accordance with the provisions of this Article.

*Article 6 — Prevention and repression of misuse*

1. The Parties shall take appropriate measures to prevent and repress any misuse of the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

2. The Parties shall also take appropriate measures to prevent and repress any misuse of the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

3. The Parties shall also take appropriate measures to prevent and repress any misuse of the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

4. The Parties shall also take appropriate measures to prevent and repress any misuse of the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

5. The Parties shall also take appropriate measures to prevent and repress any misuse of the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

*Article 7 — Dissemination*

1. The Parties shall take appropriate measures to disseminate the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

2. The Parties shall also take appropriate measures to disseminate the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

3. The Parties shall also take appropriate measures to disseminate the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

4. The Parties shall also take appropriate measures to disseminate the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

5. The Parties shall also take appropriate measures to disseminate the Convention, in particular in the field of education, science, culture, sports, health, and the environment.

*Article 8 — Signature*

1. The Convention shall be open for signature by all States, from the date of its entry into force.

2. The Convention shall be open for signature by all States, from the date of its entry into force.

3. The Convention shall be open for signature by all States, from the date of its entry into force.

*Article 9 — Ratification*

1. The Convention shall be subject to ratification by States that have signed it.

2. The Convention shall be subject to ratification by States that have signed it.

3. The Convention shall be subject to ratification by States that have signed it.

*Article 10 — Accession*

1. The Convention shall be open for accession by all States, from the date of its entry into force.

2. The Convention shall be open for accession by all States, from the date of its entry into force.

3. The Convention shall be open for accession by all States, from the date of its entry into force.

*Article 11 — Entry into force*

1. The Government of the United States of America hereby certifies that the text of the Treaty of Commerce and Consular Rights between the United States of America and the Republic of Cuba, signed at Havana, Cuba, on the 23rd day of February, 1902, is the same as the text of the said Treaty as it appears in the Treaty Series of the United States of America, and that the said Treaty is hereby ratified on behalf of the United States of America.

*Article 12 — Treaty relations upon entry into force of this Protocol*

1. The Government of the United States of America hereby certifies that the text of the Treaty of Commerce and Consular Rights between the United States of America and the Republic of Cuba, signed at Havana, Cuba, on the 23rd day of February, 1902, is the same as the text of the said Treaty as it appears in the Treaty Series of the United States of America, and that the said Treaty is hereby ratified on behalf of the United States of America.

*Article 13 — Amendment*

1. The Government of the United States of America hereby certifies that the text of the Treaty of Commerce and Consular Rights between the United States of America and the Republic of Cuba, signed at Havana, Cuba, on the 23rd day of February, 1902, is the same as the text of the said Treaty as it appears in the Treaty Series of the United States of America, and that the said Treaty is hereby ratified on behalf of the United States of America.

a)  $\frac{1}{2} \int_{-\infty}^{\infty} \delta(x) dx = \frac{1}{2} \cdot 1 = \frac{1}{2}$

b)  $\int_{-\infty}^{\infty} \delta(x) dx = 1$


c)  $\int_{-\infty}^{\infty} \delta(x) dx = 1$

d)  $\int_{-\infty}^{\infty} \delta(x) dx = 1$

## THIRD PROTOCOL EMBLEM

(Arabic) (English) (Arabic)

*Article 1 — Distinctive emblem*



*Article 2 — Indicative use of the third Protocol emblem*